

શ્રી શેર. એમ. વી. ચાર્ટર્ડ એન્ડ કોમર્સ કોલેજ, ગોળા

Assignment

B. Com sem -5

Subject : Business Accounting -5
Digital Accounting using
Tally Prime (Major-12)

- Q.1. ડિજિટલ એકાઉન્ટિંગ માં Tally Prime નો પરિચય આપી software download કરીને કંપની બનાવવાનો પગલાવો લખો. (10 માર્ક્સ)
- Q.2. CoA માં Groups તથા Ledgers કેવી રીતે બનાવે અને ક્યા-ક્યા વિભાગે લખે. (10 માર્ક્સ)
- Q.3 વાઉચરનાં પ્રકારો જોઈકર-કી માલ્ય જણાવો. (5 માર્ક્સ)

એસાઇનમેન્ટ જમા

કરવાની તારીખ :- 22/8/2026

ક્યાન :- રૂમ નં- 20

સમય :- 9 થી 10

Shree H.M.V. Arts and Commerce college -
Una.

Assignment

વિષય:- હિસાબી અને નાકાડીય ત્રિત્રમાં ભારતીય
જ્ઞાનપુકાલી Total Marks : 25
કિલમ ગ્રેમ - 5 વર્ષ : 2026-27.

Q1. નાકાડીય વ્યવસ્થાપનમાં અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનો
જ્ઞાન સમજાવો (10 Marks)

Q2. લેખપદ્ધતિ (મધ્યયુગીન હિસાબી ઉત્પત્તિ) અને તેનું
મહત્વ સમજાવો (5 Marks)

Q3. પ્રાચીન ભારતીય હિસાબી પદ્ધતિ અને આધુનિક
ડબલ એન્ટ્રી સિસ્ટમ વચ્ચે તુલના કરો. (5 Marks)

Q4. પરંપરાગત એકાઉન્ટન્ટ મુનિમની ભૂમિકા સમજાવો. (5 Marks)

નોંધ: એસાઈનમેન્ટ જમા કરવાની અને ટેસ્ટની
તારીખ 18/08/26 (મંગળવાર) રહેશે.
સમય:- 9 થી 10.
કેમ નંબર: 20.

ASSIGNMENTS - 2026 - 27

B.COM. SEM - 5 (NEP)

SUBJECT : CORPORATE ACCOUNTING - 1

MAJOR - 13

MARKS : 25

અન. ૧. માનસંગીયા લિ. નું તા. ૩૧/૦૩/૨૦૨૫ ના રોજનું
પાકું સરવૈયું નીચે મુજબ છે. (10 MARKS)

વિગત .

૩.

૩.

I ઇકિવરી અને દેવા :

૧, શોરદોલ્ડરના ભંડોળો :

(A) શોરમૂકી :

→ 120000 ઇકિવરી શોર
દરેક રૂ. 10 નો ભરપાઈ

12,00,000

→ 15% ના 5000 રોકી.

પ્રેક્કરનશ શોર શોરદોલ્ડ
રૂ. 90 ભરપાઈ

4,50,000

16,50,000

(B) અનામત અને વધારો

સામાન્ય અનામત
નફાનુકસાન પાકું
જામનગરી પ્રામિયમ

2,25,000

1,40,000

30,000

3,95,000

૨, ચાલુ દેવા :

વેપારી દેવાં - લેણદારો

1,75,000

22,20,000

II મિલકતો :

૧, અનચાલુ મિલકતો :

(A) કાયમી મિલકતો

15,20,000

17,95,000

(B) અનચાલુ રોકાણો

2,75,000

૨, ચાલુ મિલકતો :

(A) રોકડ - બેંક

2,00,000

4,25,000

(B) અન્ય ચાલુ મિલકતો

2,25,000

22,20,000

કંપની દ્વારા નોંધાયેલો ના પાલન રના છે
રોકીમેબલ પ્રેક્કરનશ શોર 10% પ્રામિયમે પરત કરવાના
છે. નવા બેંકમિલક રૂ. 1,70,000 દેવામાં રૂ. 15,000
છે. બધા રોકાણો રૂ. 2500000 માં વેચ્યા. કંપનીએ
જરૂરી સંખ્યામાં રૂ. 100 નો એક એવા ઇકિવરી શોર
10% પ્રામિયમે બહાર પાડ્યા જે ભરપાઈ થયા.
માનસંગીયા લિ. ના ચીપડે જરૂરી મામનોંધ
લખો.

શ્રેણી-૨. બેદરકારિયા સિ. ના. ના. ૩૧/૦૩/૨૦૨૬ ના રોજ
બાકીઓ નામે મુજબ હતા. (10 Marks)

શોરમૂકા :

૩.

1600 ઇકિવરો શોર દરેક	
રૂ. 100 નો ભરપાઈ	1,60,000
૪૧. ના 1200 ક્યુ. ટ્રેક. શોર	
દરેક રૂ. 100 નો ભરપાઈ	1,20,000
પ્રાથમિક ખર્ચ	24,000
જામના ૦૦૨ પ્રાથમિક	40,000
દેવાદારો	19,360
ર-ટોક	4,000
પાઇડી	12,000
લેવાદારો	16,000
જામના મકાન	64,000
મશરૂઆત	128,000
ન. નુ. પાત્ર (ઉદાર)	68,640
પેરેન્ટર	16,000

મૂકા થરાડા ના નામે મુજબ ના યોજના ફોલ્યુનલે
મંજૂર કરી

- (1) પ્રત્યેક ઇકિવરો શોર રૂ. ૧૦ લેખે થરાડવો
 - (2) પ્રત્યેક ટ્રેકરન્સ શોર રૂ. ૧૦ મુદ્દા થરાડવો
 - (3) દોલ્લા બે વર્ષના ટ્રેકરન્સ શોર ૫૨ રિવિઝન્સ નાદર
થયુ નથા અને બાકી છે. લેના પ્રત્યેક રૂ. 100 ના
બદલામાં 50% ભરપાઈ થયેલ એક નવો ઇકિવરો
શોર આપવો.
 - (4) જે અરેખર દેવું નથા એવા જમા બાકીઓ અને
જે અરેખર લેવું નથા એવા ઉદાર બાકીઓ તેમજ
અદરથ મિલકતો માંડી પાળવા.
 - (5) મિલકતોના ફેર આંકવન કરીને કિંમતમાં નામે
મુજબ થરાડો કરવો.
જામના મકાન રૂ. 24800 મશરૂઆત રૂ. 49600
ઉપરકિલ વિગતો ને આદારે જરૂરી આમનોંધ
લખી.
- શ્રેણી-૩ ઉપરકિલ વિગતો ને આદારે મૂકા થરાડા
પછીનું પાકું સરવેયું બનાવો (5 Marks)

NOTE : ઉપરકિલ Assignments Dt. 17/8/26
ના રોજ B.com.5 ના રોજ ^{સામવાર} વર્ગખંડમાં
સવાર ના ૧૫.10 દરમિયાન લેવાશે
તેજ દિવસે Internal Test પણ
લેવાશે જેના નોંધ લેવા

શ્રી ઓ. એમ. વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉના

શૈક્ષણિક વર્ષ 2026-27.

વિષય : અર્થશાસ્ત્ર.

ઓસાઇમેન્ટનાં પ્રશ્નો.

(1) B.com sem - 5.

મિનિ- 4 - દંદાકીય પદ્ધતિઓનું અર્થશાસ્ત્ર-1

- (1) દંદાકીય પદ્ધતિઓ શું? તેના મુખ્ય ઘટકો સમજાવો.
- (2) ભારતમાં દંદાકીય પદ્ધતિઓ પર વર્તમાન નાણાકીય નીતિની અસરોની ચર્ચા કરો.
- (3) વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ જણાવો.
- (4) ભારતમાં વેરોની કારણો અને અસરોની ચર્ચા કરો.
- (5) રાષ્ટ્રીય આવકનાં વ્યય પદ્ધતિઓ જણાવી તેની ઉપયોગિતા સમજાવો.

નોંધ :- ઓસાઇમેન્ટ તથા ટેસ્ટ લા. 19/08/2026નાં
રીજ 10 થી 11 સમય દરમિયાન રહેશે.

શ્રી એચ.એમ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉના.

અસાઇનમેન્ટ 2026

સેમેસ્ટર -5

SEC Sem-5 (Comm.) (12m)

Assignment Questions

1. Write 5 advantages of oral communication. **(6)**
2. Write 5 disadvantages of written communication. **(6)**